

ફેબ્રુઆરી 7, 2018

## બ્રામ્પટન ફાયર વિભાગ કહે છે: આ વર્ષે વેલેન્ટાઈનના દિવસે ચોકલેટ્સ ભૂલી જાવ

*કાર્યરત સ્મોક એલાર્મ્સ જેવી બીજી કોઈ વસ્તુ “આઈ લવ યૂ” કહેતી નથી*

બ્રામ્પટન, ઓન્ટેરિયો - શું આ વર્ષે એક પરિપૂર્ણ વેલેન્ટાઈન ભેટ શોધવામાં મુશ્કેલી પડી રહી છે? એવી કોઈ વસ્તુ જે બતાવે કે તમે ખરેખર કોઈની કાળજી લો છો? બ્રામ્પટન ફાયર પાસે ઓછી ખર્ચાળ, ઉચ્ચ-પ્રભાવ પાડતી ભલામણ છે જેને તમે તમારા સ્થાનિક હોમ ઇમ્પ્રુવમેન્ટ સ્ટોરમાં જોઈ શકો છો.

તમારા ઘરના દરેક માળ પર અને સૂવાની તમામ જગ્યાઓ બહાર એક કાર્યરત સ્મોક એલાર્મ રાખવું એ માત્ર એક કાયદો નથી - તે કટોકટીમાં તમે તમારા પ્રિયજનોનું સંરક્ષણ કરી શકતા હોવાનું જાણાવતી એક શ્રેષ્ઠ રીત પણ છે. સ્મોક એલાર્મ્સની કિંમત \$20 જેટલી ઓછી છે, અને તમને માનસિક શાંતિ પૂરી પાડે છે કે તમે જે લોકોની સૌથી વધારે સંભાળ લેવા ઇચ્છો છો તેઓ આગ લાગવાથી ઊભી થતી કટોકટીની ઘટનામાં નિર્ણાયક વહેલી ચેતવણી આપશે.

બ્રામ્પટન ફાયરે આ સંદેશાને પ્રોત્સાહન આપવા [એક વીડિયો](#) બનાવ્યો. આ વર્ષે વેલેન્ટાઈનના દિવસે ચોકલેટ્સ આપવાની ન બદલાતી જૂની પ્રથા ભૂલી જાવ - કાર્યરત સ્મોક એલાર્મ્સની જેમ બીજી કોઈ વસ્તુ “આઈ લવ યૂ” કહેતી નથી.

સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મને લગતી સરળ સૂચનાઓ:

- તમારા ઘરમાં દરેક માળ પર અને સૂવાની તમામ જગ્યાઓ બહાર સ્મોક એલાર્મ્સ બેસાડો. સંરક્ષણ વધારવા, ઉત્પાદકની ભલામણો અનુસાર દરેક બેડરૂમમાં સ્મોક એલાર્મ્સ બેસાડો. વિશાળ કદના ઘરોમાં વધારાના સ્મોક એલાર્મ્સની જરૂર પડી શકે.
- જો તમારા ઘરમાં ઈંધણુ-બાળતું ઉપકરણ, જગ્યા કે ઘર સાથે જોડાયેલું ગેરેજ હોય, તો સૂવાની તમામ જગ્યાઓ બહાર કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ બેસાડો. સંરક્ષણ વધારવા, ઉત્પાદકની ભલામણો અનુસાર તમારા ઘરના દરેક માળ પર કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સ બેસાડો.
- ટેસ્ટ બટન દબાવીને દર મહિને સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સનું પરીક્ષણ કરો. બેટરી દર વર્ષે બદલો.
- સમય વિતવાની સાથે સ્મોક અને કાર્બન મોનોક્સાઈડ એલાર્મ્સમાં ઘસારો લાગે છે. ઉત્પાદકની ભલામણો અનુસાર એલાર્મ્સ બદલી નાખો.

### અવતરણો (ક્વોટ્સ):

“આપણાં રહેવાસીઓની સુરક્ષા પ્રાધાન્ય ધરાવે છે, અને આપણે જાણીએ છીએ કે બ્રામ્પટનના તમામ ઘરોને કાર્યરત સ્મોક એલાર્મ્સથી સંરક્ષણ મળ્યું નથી. તમારા પ્રિયજનોને બતાવો કે તમે આ વેલેન્ટાઈનના દિવસે ખરેખર કાળજી લો છો, અને ખાતરી કરો કે આ જીવ-બચાવતું સાધન તમે તમારા ઘરમાં રાખ્યું છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“આપણે જાણીએ છીએ કે કાર્યરત સ્મોક ઍલાર્સ જીવન બચાવે છે. આ વેલેન્ટાઈનના દિવસે, તમારા જીવનમાં મહત્વની વ્યક્તિઓ વિશે વિચારો, અને ખાતરી કરો કે તેઓ માહિતગાર છે કે આગ લાગવાથી કટોકટી ઊભી થવાના કિસ્સામાં તમે તેઓને સંરક્ષણ પૂરું પાડવા મદદરૂપ થઈને તેઓને વ્હાલ કરો છો.”

- પ્રાદેશિક કાઉન્સિલર અને ચેરમેન, સામુદાયિક સેવાઓ, માઈકલ પાલેશી (Michael Palleschi)

“આગ એટલી ઝડપથી લાગતી હોય છે કે તમારી પાસે આગમાંથી બચીને સુરક્ષિતપણે બહાર નિકળવા 60 સેકન્ડ્સથી ઓછો સમય હોઈ શકે, તેથી તમે અને તમારા પ્રિયજનો માટે વહેલી ચેતવણી બચી રહેવા નિર્ણાયક મહત્વ ધરાવે છે. માત્ર કાર્યરત સ્મોક ઍલાર્સ તમને તે વહેલી ચેતવણી આપે છે.”

- ફાયર ચીફ બિલ બોયસ (Bill Boyes)

-30-

**બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે.** આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જીવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુસ્સામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)